

VEERAM SECURITIES LIMITED

Registered Office: Ground & First Floor, 7, Natvarshyam Co Op Ho S Ld
Opp. Orchid Park, Ramdevnagar Road, Sattelite, Anmedabad 380051 GJ IN
CIN: L65100GJ2011PLC064964 Email Id: compliancingveeram@gmail.com Mo.No.9925266150

Date: November 07, 2023

To,
The General Manager-Listing
Corporate Relations Department
BSE LIMITED
PJ Towers, 25th floor, Dalal Street,
MUMBAI -400 001
Scrip Code - 540252

Dear Sir/ Ma'am,

Subject: Submission of copies of Newspaper Advertisement pursuant to Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015

Reference: Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

With reference to above, please find enclosed the copy of newspaper advertisement dated 07th November 2023, which was published in Newspapers Business Standard and Jai Hind-Ahmedabad edition, regarding fixation of Record Date for the Interim Dividend declared by the Board of Directors at its meeting held on 4th November, 2023.

You are requested to take the same on records, upload at your website & intimate the same to the members of the Stock Exchange.

Thanking you,

Yours faithfully,

For, Veeram Securities Limited

MAHENDRABHAI
RAMNIKLAL SHAH

Digitally signed by
MAHENDRABHAI RAMNIKLAL
SHAH
Date: 2023.11.07 16:42:48 +05'00'

Mahendrabhai Ramniklal Shah

Managing Director

DIN: 03144827

TP SOUTHERN ODISHA DISTRIBUTION LIMITED
(Procurement Department) **TPSODL**

BPR North Star Building,
2nd Floor, Khodasingi, Berhampur, Odisha-760010

NOTICE INVITING TENDER Dt.: 07-11-2023

TP Southern Odisha Distribution Ltd. invites tender from eligible vendors for following:

Sl. No.	Tender Description	NIT Number	EMD (Rs.)	Tender Fee inclusive of GST (Rs.)	Last date and time of Payment of Tender Fee
1	Rate Contract for Hiring of Tower wagon with Operator & Helper for PAN TPSODL.	TPSODL/OT/2023-24/061	50,000	5,000	17.11.2023; 18:00 Hrs.

For detailed tender, please visit Tender Section on TPSODL website <https://www.tpsouthernodisha.com>

DELHI JAL BOARD
OFFICE OF THE ADDITIONAL CHIEF ENGINEER (M)-3,
OFFICE OF THE EXECUTIVE ENGINEER (E&M) M-3
TU BLOCK, PITAMPURA NEW DELHI-110034

"STOP CORONA : wear mask, follow physical Distancing, Maintain Hygiene"

PRESS NIT NO.18/ (E&M) M-3 (2023-24)

S. No.	Name of Work	Estimated Cost	Tender Processing Fee (in INR)	Earnest Money (in INR)	Publishing Date of Tender	Last date and time for tender download	Tender ID
1.	Operation and minor maintenance of gaseous chlorination point under EE En MM 3	Item Rate	500.00	94600.00	01.11.2023	14.11.2023 upto 1:00 PM	2023_DJB_249662_1

Further details in this regard can be seen at <https://govtprocurement.delhi.gov.in>.

(ER. PRADEEP POSWAL)
EE (E&M) M-3

Advt No J.S.V. 169(2023-2024) - RO NO 1580

VEERAM SECURITIES LIMITED
Registered Office: Ground & First Floor, 7, Natvarshyam Co. Op. Ho. S. Ld.,
Opp. Orchid Park, Ramdevnagar Road, Satellite, Ahmedabad - 380051 IN
Website : www.veeramsecurities.com | E-mail : compliancingveeram@gmail.com
Contact: +91 9925266150 | CIN : L65100G2011PLC064964

NOTICE

Notice is hereby given that pursuant to the provisions of the Section 91 of the Companies Act, 2013 read with applicable rules thereunder and Regulation 42 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, 13th November 2023 has been fixed as the Record Date for ascertaining the entitlement of members for payment of Interim Dividend of 2.5% of the Paid-Up Capital of the Company, declared by the Board of Directors on 4th November, 2023.

The Interim Dividend will be paid to the members whose name appear in the Register of Members as on the Record Date, viz. 13th November 2023.

For Veeram Securities Limited
sd/- **Mahendrabhai Ramniklal Shah**
Managing Director - DIN : 03144827

Date : 06/11/2023
Place : Ahmedabad

Can Fin Homes Ltd.
(Sponsor: CANARA BANK)
CIN: L6510MA1977PC008899
235, 2nd Floor, Kanha Capital, Opp. Express Tower Hotel, Baroda Highschool Lane, R.C. Dutt Road, Alkapur,
Vadodra - 390007. Ph. : 0265 2989134, Mob. 78250 79134

POSSESSION NOTICE [Rule 8 (1)] [For Immoveable Property]

The Authorised Officer of Can Fin Homes Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of the powers under Section 13(12) read with rule 8 of the said Act and Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notices on the dates noted against each accounts and stated hereinafter, calling upon the borrowers to repay the amount mentioned in the notices being with further interest within 60 days from the date of receipt of said notices. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the dates mentioned against each accounts. The borrowers in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Can Fin Homes Ltd. for the amounts and interest thereon mentioned against each accounts herein below:

Sr. No.	Name of Borrower	Description of Immoveable properties	Date of Demand Notice O/S. Amount Rs.	Date & Type of Possession
1	Mr. Satishkumar Tadvai and Mr. Chandubhai Vithalbhai Solanki (Guarantor)	Registration Dist. Vadodra, in the sim of Sayajipura, with Rev. Sur. No.118,119,121, Plot No B-95, Narayandham Society, Nr. Shubhixami Society, Sayaji Park, B/H Gayatri Park, Ajwa Road, Vadodra-390019 construction admeasuring 246 Sq. Feet., Land admeasuring 325 Sq.Feet. Bounded as : East: Block No B-96, West: Block No B-94, North: Block No B-93, South: 7.5 mtr. Road.	02.09.2023 Rs.10,80,487/- as on 02.09.2023 plus further interest	06.11.2023 Symbolic Possession
2	Mr. Hareshkumar Bharvani and Mrs. Reetuben Bharvani	Registration Dist. Vadodra in the sim of Gotri, with Rev.Sur. No. 866,C.S.No 1682, Shop No 2, Ground Floor, Yash Complex, Gotri Main Road,Gotri,Vadodra-390021 construction admeasuring 19.42 Sq.Mtr, Carpet Area 198 Sq.Feet Bounded as : East : Margin Land West : Shop No 1, North: Main Road After Margin, South: Shop No 3.	04.09.2023 Rs.8,06,865/- as on 04.09.2023 plus further interest	06.11.2023 Symbolic Possession

Date: 06.11.2023, Place: Vadodra
Sd/- Authorised Officer- Can Fin Homes Ltd

IndusInd Bank **INDUSIND BANK LIMITED**
FRR Dept, 11th Floor, Tower 1, One Indiabulls Centre, 841, Senapati Bapat Marg, Elphinstone Road, Mumbai 400013

Possession Notice [see rule 8(1)] (For Immoveable property)

Whereas, the Authorised Officer of the IndusInd Bank Ltd, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 07-Aug-2023 calling upon the Borrower SMHRI Occupational Health Services Private Limited and the Guarantors/Mortgagor Mr. Ranjittal Parmar, Unnati Rahulkumar Parmar and Rahulkumar Ranjittal Parmar to repay the amount mentioned in the notice being of Rs. 55,64,410.74 (Rupees Fifty Five Lacs Sixty Four Thousand Four Hundred Ten and Seventy Four Paise) as on 31-07-2023 together with further interests from 01-08-2023 plus costs, charges and expenses, etc. thereon within 60 days from the date of the said notices.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 3rd day of November of the year 2023.

The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IndusInd Bank Ltd. for an amount of Rs. 55,64,410.74 (Rupees Fifty Five Lacs Sixty Four Thousand Four Hundred Ten and Seventy Four Paise) as on 31-07-2023 and further interests from 01-08-2023 plus costs, charges and expenses etc. thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF PROPERTY
Flat no 16, 2nd Floor adm 74.35 Sqmtrs in Vishwambhar Complex, situated at village Nandavul sim bearing revenue survey no. 61/1, Dist Bharuch East: Flat no 15 West: Open space North: Flat no 13 on 2nd floor South: Open space

Date: 03.11.2023
Place: Bharuch
Sd/- Authorised Officer For IndusInd Bank Limited

IndusInd Bank **INDUSIND BANK LIMITED**
FRR Dept, 11th Floor, Tower 1, One Indiabulls Centre, 841, Senapati Bapat Marg, Elphinstone Road, Mumbai 400013

Possession Notice [see rule 8(1)] (For Immoveable property)

Whereas, the Authorised Officer of the IndusInd Bank Ltd, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 07-Aug-2023 calling upon the Borrower SMHRI Occupational Health Services Private Limited and the Guarantors/Mortgagor Mr. Ranjittal Parmar, Unnati Rahulkumar Parmar and Rahulkumar Ranjittal Parmar to repay the amount mentioned in the notice being of Rs. 55,64,410.74 (Rupees Fifty Five Lacs Sixty Four Thousand Four Hundred Ten and Seventy Four Paise) as on 31-07-2023 together with further interests from 01-08-2023 plus costs, charges and expenses, etc. thereon within 60 days from the date of the said notices.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 3rd day of November of the year 2023.

The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IndusInd Bank Ltd. for an amount of Rs. 55,64,410.74 (Rupees Fifty Five Lacs Sixty Four Thousand Four Hundred Ten and Seventy Four Paise) as on 31-07-2023 and further interests from 01-08-2023 plus costs, charges and expenses etc. thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF PROPERTY
Flat no 13, 2nd floor, adm 74.35 sqmtrs, in Vishwambhar Complex, situated at village Nandavul sim bearing revenue survey no. 61/1, Dist Bharuch. East: Flat no 14 West: Open space North: Open space South: Flat no 16 on 2nd floor.

Date: 03.11.2023
Place: Bharuch
Sd/- Authorised Officer For IndusInd Bank Limited

PARAS DEFENCE AND SPACE TECHNOLOGIES LIMITED
(CIN:L29253MH2009PLC193352)
Registered and Corporate Office: D-112, TTC Industrial Area, MIDC, Nerul, Navi Mumbai 400 706, Maharashtra, India; Tel: +91 22 6919 9999; Website: www.parasdefence.com

Extract of Statement of Unaudited Standalone and Consolidated Financial Results for the Quarter and Half Year ended September 30, 2023
(Rs. in Lakhs, except per equity share data)

Particulars	Standalone						Consolidated					
	Quarter Ended September 30, 2023	Quarter Ended June 30, 2023	Quarter Ended September 30, 2022	Half Year Ended September 30, 2023	Half Year Ended September 30, 2022	Year Ended March 31, 2023	Quarter Ended September 30, 2023	Quarter Ended June 30, 2023	Quarter Ended September 30, 2022	Half Year Ended September 30, 2023	Half Year Ended September 30, 2022	Year Ended March 31, 2023
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1 Total Income from Operations	6,107	4,570	5,568	10,677	9,812	22,261	6,241	4,926	5,673	11,167	9,845	23,065
2 Net Profit for the period/ year (before tax and Exceptional items)	1,355	817	1,254	2,172	2,261	4,672	1,217	783	1,163	2,000	2,100	4,685
3 Net Profit for the period/ year before tax (after Exceptional items)	1,355	817	1,254	2,172	2,261	4,672	1,217	783	1,163	2,000	2,100	4,685
4 Net Profit for the period/ year after tax (after Exceptional items)**	1,010	620	903	1,630	1,656	3,593	876	581	813	1,457	1,494	3,595
5 Total Comprehensive Income for the period/ year [Comprising Profit for the period/ year (after tax) and Other Comprehensive Income (after tax)]**	1,008	619	902	1,627	1,655	3,587	875	580	816	1,455	1,498	3,595
6 Equity Share Capital	3,900	3,900	3,900	3,900	3,900	3,900	3,900	3,900	3,900	3,900	3,900	3,900
7 Other Equity (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet)						33,230						33,242
8 Earnings Per Share (of Rs.10/- each)												
a) Basic (Not Annualised)*	2.59*	1.59*	2.32*	4.18*	4.25*	9.21	2.42*	1.54*	2.17*	3.96*	3.99*	9.25
b) Diluted (Not Annualised)*	2.59*	1.59*	2.32*	4.18*	4.25*	9.21	2.42*	1.54*	2.17*	3.96*	3.99*	9.25

**Includes share of Non Controlling Interest

Notes :
a) The above is an extract of the detailed format of Unaudited Financial Result of the Quarter and Half Year ended September 30, 2023 filed with the Stock Exchanges on November 06, 2023 under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the aforementioned Financial Results is available on the Stock Exchange websites (www.bseindia.com & www.nseindia.com) and the Company's Website (www.parasdefence.com).
b) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on November 06, 2023. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above results.

For Paras Defence and Space Technologies Limited
Sd/-
Shilpa Mahajan
Whole-Time Director
DIN: 01087912

Place: Navi Mumbai
Date: November 06, 2023

TMB **TAMILNAD MERCANTILE BANK**
Siddpur Branch : Door No.2-6, First Floor, Vijay Shopping Center, Dethali Circle, Opp to Circuit House, Siddpur - 384151
Email: siddpur@tmbank.in | Phone No.02767-225522

Auction Notice for Sale of Immoveable Properties

Auction Sale Notice for Sale of Immoveable Assets mortgaged / charged to the Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 8 (6) and 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower Mr. Patel Bharatkumar, S/o. Mr. Patel Kantilal and Guarantor: Mr. Patel Ankitkumar, S/o. Mr. Patel Bharatkumar that the below described immovable property mortgaged to the Secured Creditor, the constructive possession of which has been taken by the Authorized Officer of Tamilnad Mercantile Bank Limited, Siddpur Branch, will be sold "As is where is", "As is what is", and "Whatever there is" on 11.12.2023 for recovery of Rs.11,25,474.25 (Rupees Eleven Lakhs Twenty Five Thousand Four Hundred Seventy Four and Paise Twenty Five only) [Term Loan for Rs.5,90,899.99 as on 01.11.2023 and Overdraft for Rs.5,34,574.26 as on 31.10.2023] plus expenses of Rs.20,897.66 as on 31.10.2023 due to the Tamilnad Mercantile Bank Limited, Siddpur Branch with subsequent interest and future expenses.

The Reserve Price will be Rs.16,50,000/- (Rupees Sixteen Lakh Fifty Thousand Only) and the earnest money deposit will be Rs.1,65,000/- (Rupees One Lakh Sixty-Five Thousand Only)

Description of the Property
Property standing in the name of Mr. Patel Bharatkumar On equitable mortgage of land to the extent of 88.90 Sq.mt (Admeasuring 50.13 sq.mt +13.71 sq.mt (South Margin) + 25.06 Sq.mt (West Margin)) and house building constructed thereon admeasuring total build up area 106.36 Sq.mts (GF 50.13 Sq.mt + F.F. 50.13 Sq.mt+ Cabin 6.10 sq.mt as per approved plan) and situated at R.S.No.8/1, Gala No.7, Gram Panchayat, Akarni No.643, Property No.5/7 Patel Paru, Tavadiya, Siddpur

Boundaries: North :Road, South :Margin Land, East : Plot No.8, West : Margin Land
Note: (The above security is common for the Home Loan (Account number -332700950100028) Limit of Rs.8,00,000/- (Balance outstanding is Rs.5,90,899.99 as on 01.11.2023) availed in the name of Mr. Patel Bharatkumar.
[Note - The Secured creditor has already issued sale notice under Rule 8(6) of Security Interest (Enforcement) Rules under SARFAESI Act to the borrowers and guarantors on 03.10.2023 for redemption of property by granting 30 days' time as per the Act and failed to remit the entire due amount]

For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditors website (www.tmb.in)

Place: Siddpur
Date: 06.11.2023
Authorized Officer
Tamilnad Mercantile Bank Ltd
Ahmedabad Region [For Siddpur Branch]

JAMNA AUTO INDUSTRIES LIMITED
CIN - L35911HR1965PLC004485
Regd. Office: Jai Springs Road, Industrial Area, Yamuna Nagar - 135001, Haryana
Phone & Fax: 01732-251810/11/14, E-mail: investor.relations@jaispring.com, Website: www.jaispring.com

STATEMENT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2023
(Rs. in Lakhs)

S. No.	Particulars	Quarter ended			Half year ended			Year ended
		Unaudited 30.09.2023	Unaudited 30.06.2023	Unaudited 30.09.2022	Unaudited 30.09.2023	Unaudited 30.09.2022	Audited 31.03.2023	
		1 Total Income from operations	60,735.65	57,526.25	55,274.24	118,261.90	110,043.45	
2 Net Profit/ (Loss) for the period (before tax, exceptional items)	6,873.23	6,275.92	5,196.19	13,149.15	10,268.54	22,938.00		
3 Net Profit/ (Loss) for the period before tax (after exceptional items)	6,873.23	6,275.92	5,196.19	13,149.15	10,268.54	22,938.00		
4 Net Profit/ (Loss) for the period after tax (after exceptional items)	5,010.72	4,559.26	3,733.22	9,569.98	7,475.99	16,836.79		
5 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	4,918.73	4,563.87	3,678.40	9,482.60	7,436.85	16,865.13		
6 Equity Share Capital	3,986.93	3,986.93	3,984.84	3,986.93	3,983.84	3,986.93		
7 Reserves (excluding Revaluation Reserve)				79,583.69	68,033.90	74,440.41		
8 Earnings Per Share (of Rs. 1/- each) (not annualised) (In Rs.)								
Basic:	1.26	1.14	0.94	2.40	1.88	4.23		
Diluted:	1.25	1.14	0.93	2.39	1.87	4.21		

Notes :
1. The above consolidated financial results of Jamna Auto Industries Limited ("the parent Company") and its subsidiaries (together referred as "the Group") for the quarter and half year ended September 30, 2023 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on November 06, 2023.
2. Information of standalone audited financial results in terms of the Listing Regulations is as under:

S. No.	Particulars	Quarter ended			Half year ended			Year ended
		Unaudited 30.09.2023	Unaudited 30.06.2023	Unaudited 30.09.2022	Unaudited 30.09.2023	Unaudited 30.09.2022	Audited 31.03.2023	
		1 Revenue from operations	58,824.51	55,936.22	53,068.36	114,760.73	106,601.97	
2 Profit before tax	10,269.57	6,201.83	4,933.38	16,471.40	9,612.22	21,280.80		
3 Total Comprehensive income for the period	8,401.30	4,614.93	3,582.18	13,016.23	7,078.24	15,794.81		

3. The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchanges websites viz. www.bseindia.com and www.nseindia.com and website of the Company at www.jaispring.com.

For Jamna Auto Industries Ltd
P. S. Jauhar
Managing Director & CEO
DIN 00744518

Date : November 06, 2023
Place : New Delhi

pnb **पंजाब नैशनल बैंक** **punjab national bank** **C0: Mehsana, Madhuvan Complex, Highway Road, Mehsana Ph. 02762-255920. Mail: bo3944@pnb.co.in**

60 Days Notice to Borrower
Date: 10.10.2023

To,
1. M/s. Shri Manikrupa Aluminium Fabrication - Prop. Hasmukhbhai B. Raval
G-21, 22 Safal Shopping Centre, Nr. Vimal Engineering, Modhera Chokdi, Mehsana, Gujarat - 384002.
2. Mr. Hasmukhbhai Bhimabhai Raval (Borrower/Mortgagor)
3. Shri Sureshbhai Bhimabhai Raval (Guarantor / Mortgagor)
2 and 3 having Add. at: Shed No. C/3, Sai Industries Estate, Nugar Bypass Circle, Mehsana - 384002.

Dear Sir/Madam,
NOTICE UNDER SECTION 13(2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002 (SARFAESI)
Reg: Account No. 3944009300005694 and 394400100000012 credit facilities availed by M/s. Shri Manikrupa Aluminium Fabrication (Prop. Hasmukhbhai Raval)
You, Shri Manikrupa Aluminium Fabrication (Prop. Hashmukh Bhimabhai Raval) have availed the following credit facilities.

Facility	Limit	Rate of Int.	Balance O/S as on date 29.09.2023 Date of NPA (i.e. Principal and Int. calculated up to 30.08.2023)	Interest (w.e.f. 31.08.2023 to 09.10.2023)	Recovery after NPA up to 09.10.2023	Total Outstanding as on date 09.10.2023
Overdraft Against IP 3944009300005694	Rs. 15,00,000.00	11.60%	Rs. 11,44,774.86	Rs. 14,668.36	Nil	Rs. 11,59,443.22
GECL A/c. 394400100000012	Rs. 2,90,000.00	9.25%	Rs. 87,849.00	Rs. 890.36	Nil	Rs. 88,739.36
Total	Rs. 17,90,000.00		Rs. 12,32,623.86	Rs. 15,558.72	NIL	Rs. 12,48,182.58

Due to non-payment of installment / interest / principal debt, the accounts has/have been classified as **Non-Performing Asset** on 29.09.2023 as per Reserve Bank of India guidelines. We hereby demand/recall the entire outstanding together with interest and other charges due under the above facilities and we also invoke the guarantee for the above mentioned facilities to the borrower.

The amount due to the Bank as on 09.10.2023 of Rs. 12,48,182.58 (Rupees Twelve Lakhs Forty Eight Thousand One Hundred Eighty Two and Paise Fifty Eight Only) with future interest w.e.f. 09.10.2023 until payment in full. (hereinafter referred to as "secured debt"). To secure the outstanding under the above said facilities, you have, inter alia, created security interest in respect of the following properties/assets:

Nature of Facility	SECURITY
Overdraft against IP (A/c. 3944009300005694)	(1) All the piece and parcel of Property Consisting Plot No. 15 as per sale deed (House No. 4/030 as per Assessment Certificate) of Ramdevnagar which is situated in Survey No. 718/2p PF Palasar Sim, Taluka Chanasma & Dist. Patan. Adm. 30.25 Sq. Mtrs. Bonded by: East: Plot No. 14, West: Plot No. 16, North: Road, South: Road.
Term Loan GECL (A/c. 394400100000012)	(2) All the piece and parcel of Property Consisting Plot No. 14 as per sale deed (House No. 4/028 as per Assessment Certificate) of Ramdevnagar which is situated in Survey No. 718/2p Opp. Palasar Sim, Taluka Chanasma & Dist. Patan. Adm. 69.41 Sq. Mtrs. Bonded by: East: Plot No. 13, West: Road, North: Road, South: Road.

We hereby call upon you to pay the amount of Rs. 12,48,182.58 (Rupees Twelve Lakhs Forty Eight Thousand One Hundred Eighty Two and Paise Fifty Eight Only) with future interest and charges at the contracted rate until payment in full within 60 days (sixty days) from the date of this notice. In default, besides exercising other rights of the Bank as available under Law, the Bank is intending to exercise any or all of the powers as provided under section 13(4) of the SARFAESI Act 2002. (hereinafter referred to as "the Act") The details of the secured assets intended to be enforced by the Bank, in the event of the non-payment of secured debt is given above.

Your attention is hereby drawn invited to provisions of sub-section(8) of section 13 of the Act in respect of time available to you to redeem the secured assets. Please take notice that in terms of section 13(13) of the said Act, you shall not, after receipt of this notice, transfer by way of sale, lease or otherwise (other than in the ordinary course of business) any of the secured assets above referred to, without prior written consent of the Bank. You are also put on notice that any contravention of this statutory injunction/restraint, as provided under the said Act, is an offence.

If for any reason, the secured assets are sold or leased out in the ordinary course of business, the sale proceeds or income realised shall be deposited/remitted with/to the Bank. You will have to render proper account of such realisation / income.

* We reserve our rights to enforce other secured assets.
Please comply with this demand under this notice and avoid all unpleasantness. In case of non-compliance, further needful action will be resorted to, holding you liable for all costs and consequences.
* This notice is issued without prejudice to the bank taking legal action DRT / Court, as the case may be
* This notice issued without prejudice to the bank's rights in the suit/litigation pending before DRT / Court as a case may be.

Place: Ahmedabad
Sd/- Authorised Officer, PUNJAB NATIONAL BANK

